

Ref: SECTL/2024 - 141

October 17, 2024

BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
G-Block, Dalal Street,
MUMBAI - 400 001

National Stock Exchange of India Limited
Exchange Plaza, 5th Floor, Plot No. C/1,
Bandra-Kurla Complex, Bandra (East)
MUMBAI - 400 051

Scrip Code: BSE - 532974

NSE - BIRLA MONEY

Sub: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations 2015 - Newspaper Advertisement of Un-Audited Financial Results for the Quarter and Half Year Ended 30th September 2024.

Dear Sir / Madam,

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 please find enclosed herewith the Newspaper clippings of the Extract of the Un-audited Financial Results for the Quarter and Half Year Ended 30th September 2024, published as per Regulation 47(1)(b) of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015 in English Newspaper (Business Standards) and in Regional Language Newspaper (Jai Hind) on 17th October 2024. The Same shall also be uploaded on the Company's Website <https://stocksandsecurities.adityabirlacapital.com>.

You are requested to take the same on your record.

Yours Faithfully,
For **Aditya Birla Money Limited**

Manisha Lakhotia
Company Secretary & Compliance Officer
Membership No. A46126
Encl.: A/A

Continue From Previous Page...

CONTENTS OF THE MEMORANDUM OF ASSOCIATION OF OUR COMPANY AS REGARDS ITS OBJECTS: For information on the main objects and other objects of our Company, see "History and Certain Corporate Matters" on page 159 of the RHP. The Memorandum of Association of our Company is a material document for inspection in relation to the Issue. For further details, see the section "Material Contracts and Documents for Inspection" on page 337 of the RHP.

LIABILITY OF MEMBERS OF THE COMPANY: Limited by shares.

AMOUNT OF SHARE CAPITAL OF THE COMPANY AND CAPITAL STRUCTURE: The authorised share capital of the Company is ₹ 25,00,00,000 divided into 2,50,00,000 Equity Shares of ₹ 10 each. The issued, subscribed, and paid-up share capital of the Company before the Issue is ₹ 17,85,00,000 divided into 1,78,50,000 Equity Shares of ₹ 10 each. For details of the Capital Structure, see chapter titled "Capital Structure" beginning on page 85 of the RHP.



NAMES OF THE SIGNATORIES TO THE MEMORANDUM OF ASSOCIATION OF THE COMPANY AND THE NUMBER OF EQUITY SHARES SUBSCRIBED BY THEM: Given below are the names of the signatories of the Memorandum of Association of the Company and the number of Equity Shares subscribed by them at the time of signing of the Memorandum of Association of our Company: Omega Bright Steel & Components Private Limited- 1,00,000 Equity Shares, Ashwani Leekha - 1,00,000 Equity Shares of ₹ 10 each.

LISTING: The Equity Shares issued through the Red Herring Prospectus are proposed to be listed on the Emerge Platform of National Stock Exchange of India Limited ("NSE emerge") in terms of the Chapter IX of the SEBI (ICDR) Regulations, as amended from time to time. Our Company has received an approval letter dated October 01, 2024, from NSE for using its name in the Issue Document for listing of our shares on the Emerge Platform of NSE. For the purpose of this Issue, the Designated Stock Exchange will be the NSE.

DISCLAIMER CLAUSE OF SECURITIES AND EXCHANGE BOARD OF INDIA ("SEBI"): Since the issue is being made in terms of chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, the Red Herring Prospectus has been filed with SEBI. In terms of the SEBI Regulations, the SEBI shall not issue any observation on the Issue Document. Hence there is no such specific disclaimer clause of SEBI. However, investors may refer to the entire Disclaimer Clause of SEBI beginning on page 264 of the Red Herring Prospectus.

DISCLAIMER CLAUSE OF NSE ("NSE EMERGE") (THE DESIGNATED STOCK EXCHANGE): It is to be distinctly understood that the permission given by NSE should not in any way be deemed of construed that the Issue Document has been cleared or approved by NSE nor does it certify the correctness or completeness of any of the contents of the Issue Document. The investors are advised to refer to page 266 of the RHP for the full text of the Disclaimer Clause of NSE.

GENERAL RISK: Investments in equity and equity-related securities involve a degree of risk and investors should not invest any funds in this Issue unless they can afford to take the risk of losing their investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in this Issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue including the risks involved. The Equity Shares issued in the Issue have neither been recommended nor approved by Securities and Exchange Board of India nor does Securities and Exchange Board of India guarantee the accuracy or adequacy of the Red Herring Prospectus. Specific attention of the investors is invited to the section titled "Risk Factors" beginning on Page 31 of the Red Herring Prospectus.

BOOK RUNNING LEAD MANAGER	REGISTRAR TO THE ISSUE	COMPANY SECRETARY & COMPLIANCE OFFICER
 <p>UNISTONE CAPITAL PRIVATE LIMITED A/305, Dynasty Business Park Andheri-Kurla Road, Andheri East, Mumbai - 400 059. Telephone: 022 4604 6494 Email: mb@unistonecapital.com Investor grievance email: compliance@unistonecapital.com Contact Person: Brijesh Parekh Website: www.unistonecapital.com SEBI registration number: INM000012449 CIN: U65999MH2019PTC330850</p>	 <p>BIGSHARE SERVICES PRIVATE LIMITED S6-2, 6th Floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East), Mumbai - 400093, Maharashtra, India Telephone: 022-6263 8200 Email: ipo@bigshareonline.com Contact Person: Babu Rapphal C Website: www.bigshareonline.com SEBI Registration Number: INR000001385 CIN: U99999MH1994PTC0765346</p>	<p>Abhishek Kumar Pandey OBSC Perfection Limited 6F, 6th Floor, M-6, Uppal Plaza, Jasola District Centre, South Delhi- 110025, India Tel No.: 011-2697 2586 Website: www.obscperfection.com Email id: abhishek@obscperfection.com</p> <p>Investors can contact the Company Secretary and Compliance Officer, BRLM or the Registrar to the Issue in case of any pre- issue or post issue related problems, such as non-receipt of letters of Allotment, non-credit of Allotted Equity Shares in the respective beneficiary account, non-receipt of refund orders or non-receipt of funds by electronic mode.</p>

AVAILABILITY OF RHP: Investors should note that investment in Equity Shares involves a high degree of risk and investors are advised to refer to the Red Herring Prospectus and the Risk Factor contained therein, before applying in the Issue. Full copy of the Red Herring Prospectus shall be available at the website of Stock Exchange www.nseindia.com, the website of Book Running Lead Managers www.unistonecapital.com and from the Registered Office of the Company.

AVAILABILITY OF BID-CUM-APPLICATION FORMS: Bid-Cum-Application forms can be obtained from the Registered Office of the Company: **OBSC Perfection Limited** (Telephone: 011-2697 2586) **BRLM: Unistone Capital Private Limited** (Telephone: 022-4604 6494) **Syndicate Member: R.K. Stock Holding Private Limited** (Telephone: +91-11 4856 4444), Registered Brokers, RTA and CDPs participating in the Issue. Bid-cum-application Forms will also be available on the websites of, NSE (www.nseindia.com) and the designated branches of SCSBs, the list of which is available at websites of the Stock Exchange and SEBI.

SYNDICATE MEMBER: R.K. Stock Holding Private Limited

BANKERS TO THE ISSUE/ SPONSOR BANK / ESCROW COLLECTION BANK / PUBLIC ISSUE BANK / REFUND BANK: Kotak Mahindra Bank Limited

UPI: UPI Bidders can also Bid through UPI Mechanism

All capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the RHP.

For OBSC PERFECTION LIMITED
On Behalf of the Board of Directors
Sd/-
Saksham Leekha
Managing Director

Place: Delhi
Date: October 16, 2024

OBSC PERFECTION LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the RHP with Registrar of Companies, Delhi on October 16, 2024. The RHP shall be available on the website of the BRLM to the issue at www.unistonecapital.com and websites of NSE i.e. www.nseindia.com. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, see section titled "Risk Factors" beginning on page 31 of the RHP. Potential investors should not rely on the DRHP for making any investment decision.

The Equity Shares issued in the issue have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the "Securities Act") or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act and any applicable U.S. state securities laws. There will be no public offering in the United States and the securities being issued in this announcement are not being offered or sold in the United States.

ASSAM POWER DISTRIBUTION COMPANY LIMITED
(A Govt. of Assam Public Limited Company)
TENDER NOTICE No. 24/5

E-Tenders in two parts viz. 1) Techno Commercial Bids and 2) Price Bids, with validity up to 180 days are hereby invited from reputed, experienced (Electrical Contractors/ Original Equipment Manufacturers (OEMs) having valid Electrical Contractor's License up-to 11 kV issued by competent authority for supply and erection of Fiber Reinforced Plastic (FRP) Fencing around distribution transformers at various locations under APDCL. Interested bidders may view the detailed Request for Proposal (RFP) on website www.assamtenders.gov.in as well as www.apdcl.org.

Description	Date & Time
Tender document publishing date	19-10-2024 at 17:00 hrs.
Pre-Bid Meeting	25-10-2024 at 13:00 hrs.
Bid Submission start date and time	30-10-2024 from 12:00 hrs.
Bid submission end date and time	13-11-2024 till 17:00 hrs.
Technical Bid Opening Date & time	14-11-2024 at 16:00 hrs.

Sd/- Chief General Manager (PP&D), APDCL

Please pay your energy bill on time and help us to serve you better!

The Singareni Collieries Company Limited
(A Government Company)
Regd. Office: KOTHAGUDEM - 507101, Telengana.

Expression of Interest

Invitation of Expression of Interest for Issuing fly ash from pond on Free of cost basis.

Fly ash from pond is available to issue on "free of cost basis" to fly ash user agencies from Singareni Thermal Power Plant. Expression of Interest is to be submitted on or before 26.10.2024 in prescribed formats.

For details please visit <https://www.sccmlines.com>
Contact Numbers: 9491144990, 9491144235.

PR/2024-25/ADVT/STPP/47
R.O. No.: 525-PP/CL-AGENCY/ADVT/1/2024-25 Executive Director (HOP) STPP

FACT दि फर्टिलाइजर्स एण्ड केमिकल्स ट्रान्कोर लिमिटेड
THE FERTILISERS AND CHEMICALS TRAVANCORE LIMITED
(A Government of India Enterprise) Regd. Office: Eloor
Corporate Materials, FACT PD Administration Building, Udyogamandal, Kochi-683 501 (Kerala), Tel: (0484)-256 8345/8273, E-mail: deepakvs@factltd.com, aneeshya@factltd.com, Website: <http://www.fact.co.in>

TENDER FOR ENGAGING SERVICES OF 2 DOCTORS AND 4 MALE NURSES FOR FACT
[Enquiry No. MM/181/30261 dated 16.10.2024]

Sealed Competitive Bids, Open-Tender (two part) are invited from Multi Speciality Hospitals in/around Ernakulam for providing the services of two (2) doctors and four (4) male nurses for FACT for a period of two years. Kindly visit <https://www.fact.co.in> for accessing the tender documents. Any change / Extensions to this tender will be informed only through our website and will not be published in newspapers. Due date/ time for submission of bids is 06.11.2024 / 2:00 PM.

Sd/-
Sr. Manager (Materials)-T&S

सेन्ट्रल बैंक ऑफ़ इंडिया
Central Bank of India

1911 से आपके लिए "केंद्रित" "CENTRAL" TO YOU SINCE 1911

Central Office: Chander Mukhi, Nariman Point, Mumbai-400021
Tel.No.:022-66387575, Website: www.centralbankofindia.co.in

TENDER FOR EXPRESSION OF INTEREST FOR APPOINTMENT OF LEGAL COUNSEL
CENTRAL BANK OF INDIA invites Bids for selection of Legal Counsel for raising equity capital through Qualified Institutions Placement (QIP) from eligible Legal Counsels. For detailed information and addendum, please refer RFP document available on our website: <https://www.centralbankofindia.co.in/en/active-tender>
Last date and time for Bid Submission is now extended till 23.10.2024 upto 17.00 Hrs.

For further clarification, contact on e-mail: agmcompsec@centralbank.co.in. Tel: 022-66387575.
Place: Mumbai
Date: 16.10.2024

Sd/-
Company Secretary

ADITYA BIRLA CAPITAL
STOCKS & SECURITIES

Regd. Office: Indian Rayon Compound, Veraval - 362 266, Gujarat; CIN: L65993GJ1995PLC064810; Email: abml.investorgrievance@adityabirlacapital.com; Website: <https://stocksandsecurities.adityabirlacapital.com>; Tel.: +91-44-49490000; Fax.: +91-44-22501095.

TOTAL INCOME - YOY

31%
Q2 FY 25

PAT - YoY

40%
H1 FY 25

RoE

124%
Q2 FY 25

102%
H1 FY 25

47%
H1 FY 25

An Extract of the Unaudited Financial Results for the Quarter and Half Year Ended September 30, 2024
(Rupees in Lakhs) Except earning per share

Sr No.	Particulars	Quarter Ended			Half Year Ended		Year Ended
		September 30, 2024	June 30, 2024	September 30, 2023	September 30, 2024	September 30, 2023	March 31, 2024
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Total Income from Operations	12,565.70	11,785.61	9,636.92	24,351.31	17,482.28	39,019.32
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	3,620.90	2,232.58	1,681.01	5,853.48	2,986.10	6,893.05
3.	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	3,620.90	2,232.58	1,681.01	5,853.48	2,986.10	6,893.05
4.	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	2,668.75	1,636.27	1,192.05	4,305.02	2,135.96	5,296.80
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	2,673.64	1,633.73	1,211.29	4,307.37	2,156.22	5,334.31
6.	Paid-up Equity Share Capital (Face Value of Re.1/- each)	565.09	565.09	565.09	565.09	565.09	565.09
7.	Reserves (excluding Revaluation Reserve)	20,013.09	17,339.45	12,527.64	20,013.09	12,527.64	15,705.72
8.	Securities Premium Account	565.75	565.75	565.75	565.75	565.75	565.75
9.	Debt Redemption Reserve	-	-	-	-	-	-
10.	Capital Redemption Reserve	-	-	-	-	-	-
11.	Net Worth	20,578.18	17,904.54	13,092.73	20,578.18	13,092.73	16,270.81
12.	Outstanding Debt	1,50,760.39	1,38,184.67	1,08,676.11	1,50,760.39	1,08,676.11	1,37,463.25
13.	Outstanding Redeemable Preference Shares (Nos. in lakhs)	16.00	16.00	16.00	16.00	16.00	16.00
14.	Debt Equity Ratio (No. of Times)	7.33	7.72	8.30	7.33	8.30	8.45
15.	Debt Service Coverage Ratio (No. of Times)	0.15	0.14	0.13	0.14	0.12	0.11
16.	Interest Service Coverage Ratio (No. of Times)	2.32	1.85	1.92	2.09	1.87	1.85
17.	Earnings Per Equity Share (of Re.1/- each)	4.72	2.90	2.11	7.62	3.78	9.37
	(a) Basic						
	(b) Diluted	4.72	2.90	2.11	7.62	3.78	9.37
	(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Annualised)

Notes:
1. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its Meeting held on October 16, 2024. The Unaudited Financial Results of the Company for the Quarter and Half Year Ended September 30, 2024 have been subjected to Limited Review by the Auditors.
2. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulations 33 and 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. For the items referred in relevant sub-clauses of Regulation 52(4) of the SEBI Listing Regulations, the pertinent disclosures have been made to the Stock Exchanges viz. National Stock Exchange of India Limited and BSE Limited and the full format of the Unaudited Financial Results is available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website <https://stocksandsecurities.adityabirlacapital.com>.
3. The previous period figures have been regrouped / rearranged wherever necessary.

By Order of the Board
For Aditya Birla Money Limited
Tushar Shah
Director
DIN: 00239762

Place: Mumbai
Date: October 16, 2024

JM FINANCIAL CREDIT SOLUTIONS LIMITED
Corporate Identity Number : U74140MH1980PLC022644
Regd. Office : 7th Floor, Chenergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai 400 025.
Tel. No.: +91 22 6630 3030 • Fax No.: +91 22 6630 3223
Website: www.jmfinancialcreditsolutions.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED SEPTEMBER 30, 2024
(₹ in Crore)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended
		30.09.2024 Unaudited	30.09.2023 Unaudited	31.03.2024 Audited
1	Total Income from Operations	217.88	318.32	1,304.82
2	Profit before Tax for the period / year (before, Exceptional and / or Extraordinary items)	(107.13)	23.44	66.90
3	Profit before Tax for the period / year (after, Exceptional and / or Extraordinary items)	(107.13)	23.44	66.90
4	Net Profit for the period / year	(88.43)	17.39	47.16
5	Total Comprehensive Income	(87.92)	4.71	(43.31)
6	Paid up Equity Share Capital	2.83	2.83	2.83
7	Reserves (Excluding Revaluation Reserve)	4,158.26	4,268.01	4,209.91
8	Securities Premium Account	1,715.28	1,715.28	1,715.28
9	Net Worth	4,161.09	4,270.84	4,212.74
10	Outstanding Debt	4,448.86	6,235.62	6,050.92
11	Outstanding Redeemable Preference Shares	None	None	None
12	Debt Equity Ratio	1.07	1.46	1.44
13	Earnings Per Share			
	Basic EPS (in ₹) (Not annualised)	(312.85)	61.54	166.83
	Diluted EPS (in ₹) (Not annualised)	(312.85)	61.54	166.83
14	Capital Redemption Reserve	NA	NA	NA
15	Debt Redemption Reserve	NA	NA	NA
16	Debt Service Coverage Ratio	NA	NA	NA
17	Interest Service Coverage Ratio	NA	NA	NA

Notes:
1. The above results for the quarter and half year ended September 30, 2024, have been reviewed by the Audit Committee and on its recommendation, have been approved by the Board of Directors of the Company at its meeting held on October 15, 2024. The said results have been subjected to limited review by the Statutory Auditors of the Company, who have issued an unmodified report thereon.
2. The above financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS notified under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and as per the format prescribed under Regulation 52 of the SEBI (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015 (SEBI Listing Regulations), as amended and read with the operational circular for listing obligation and disclosure requirement dated July 29, 2022.
3. The above is an extract of the detailed format of unaudited financial results filed with BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) (collectively referred as Stock Exchanges) under Regulation 52 of the SEBI Listing Regulations. The full format of said unaudited financial results are available on the websites of BSE at www.bseindia.com and NSE at www.nseindia.com and on the website of the Company at www.jmfinancialcreditsolutions.com.
4. The other details required under Regulation 52(4) of the SEBI LODR have been submitted to the Stock Exchanges and can be accessed at www.bseindia.com and www.nseindia.com.

For and on behalf of the Board of Directors
Sd/-
Vishal Kampani
Vice Chairman and Managing Director
(DIN: 00009079)

Place: Mumbai
Date: October 15, 2024

